Λ (VIND SMA(TSPACES

www.arvindsmartspaces.com

30th April, 2020

To,

BSE Limited

Listing Dept. / Dept. of Corporate Services, Phiroze Jeejeebhov Towers,

Dalal Street,

Mumbai - 400 001.

Security Code: 539301
Security ID : ARVSMART

Dear Sir/Madam,

To,

National Stock Exchange of India Limited

Listing Dept., Exchange Plaza, 5th Floor,

Plot No. C/1, G. Block, Bandra-Kurla Complex,

Bandra (E),

Mumbai - 400 051.

Symbol: ARVSMART

Sub.: Newspaper Advertisement - Notice of Postal Ballot for approval of proposed Amendments in the Memorandum and Articles of Association of Arvind SmartSpaces Limited ("the Company") through remote E-Voting.

Ref.: Regulation 30 and 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

With reference to the captioned subject and in continuation of our intimations dated 25th April, 2020 and 28th April, 2020, we are submitting herewith the copy of advertisement published in connection with the Notice of Postal Ballot through remote E-Voting of the Company, in Financial Express (English & Gujarati) on Thursday, 30th April, 2020.

In view of the emergency situation arising due to spread of COVID-19 and to support the lock down initiative(s) taken by the Central Government at national level and in compliance with Policy of Work from Home of the Company, we are submitting this disclosure/announcement without signature.

You are requested to kindly take the above information on record.

Thanking you,

Yours faithfully,

For Arvind SmartSpaces Limited

Sd/-

Prakash Makwana Company Secretary

Contact: +91 9898082608

Arvind SmartSpaces Limited

Regd. Office: 24, Government Servant Society,

Near Municipal Market, Off C. G. Road,

Navrangpura, Ahmedabad, 3800 009, India Tel.: +91 79 68267000 Fax.: +91 79 68267021

CIN: L45201GJ2008PLC055771

FINANCIAL EXPRESS

indianexpress.com

ARVIND SMARTSPACES LIMITED

Regd. Off: 24, Government Servant's Society, Near Municipal Market, Off. C. G. Road, Navrangpura, Ahmedabad-380009. Tel.: +91 7968267000, Email: investor@arvindinfra.com Website: www.arvindsmartspaces.com

NOTICE OF POSTAL BALLOT (THROUGH REMOTE E-VOTING)

Notice is hereby given, pursuant to the provisions of Section 110 of the Companies Act, 2013 ('the Act') read with Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 ('the Rules'), the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('SEBI LODR Regulations'), General Circular No. 14/2020 dated 8th April, 2020 and General Circular No. 17/2020 dated 13th April, 2020 issued by Ministry of Corporate Affairs ('the General Circulars'), that the Company is seeking approval of members for the special businesses as set out in the postal ballot notice dated 24th April, 2020 ("Postal Ballot Notice"). Members are informed that the Postal Ballot Notice along with relevant Explanatory Statement and e-voting instructions for remote e-voting have been sent to members who have registered their email addresses with the Company or Depository Participant(s) on their registered e-mail addresses as on the cut-off date.

The Postal Ballot Notice has been sent to email addresses of those members whose names appeared in the Register of Members / List of Beneficial Owners as received from the National Securities Depository Limited ('NSDL') and Central Depository Services (India) Limited ('CDSL') as on Friday, 24th April, 2020 ("the Cut - Off Date"). The voting rights shall be reckoned on the paid-up value of the shares registered in the name of members as on the Cut - Off Date. A person who is not a member as on the Cut - Off Date should treat this notice for

Members should note that due to country wide lockdown imposed by the Government of India to combat the spreading of the Novel Coronavirus ("COVID-19") and in terms of the General Circulars, no physical ballot form is being dispatched by the Company and the Members can cast their vote using remote e-voting facility only.

Pursuant to the General Circulars, Members whose email addresses were not registered with the Company or Depository Participant(s) as on the Cut - Off Date, are requested to register their email addresses by sending an email citing subject line as "ASL - Postal Ballot - Registration of e-mail addresses" to our RTA i.e. Link Intime India Private Limited at ahmedabad@linkintime.co.in or to the Company at investor@arvindinfra.com with name of registered shareholder(s), folio number(s) / DP Id(s) / Client Id(s) and No. of shares held from the email address they wish to register to enable them to exercise their vote(s) on the special businesses as set out in the Postal Ballot Notice through remote e-voting facility provided by NSDL. For details of the manner of casting voting through remote e-voting by the members holding shares in physical form or who have not registered their email addresses with the Company or Depository Participant(s), members are requested to refer instruction no. 7 of the Postal Ballot Notice.

In accordance with the provisions of Section 108 of the Act read with the Rules, the General Circulars and Regulation 44 of the SEBI LODR Regulations, the Company is providing facility to its members to exercise their votes electronically in respect of items enlisted in the Postal Ballot Notice through the remote e-voting facility provided by NSDL.

Details of Postal Ballot Schedule:

l	Sr. No.	Particulars	Schedule	
ı	1	Date of Completion of dispatch of postal ballot notice	Wednesday, 29 th April, 2020	
l	2	Cut - off date for identification of voting rights of the members	Friday, 24 th April, 2020	
ı	3	Date and time of commencement of remote e-voting	Friday, 1st May, 2020 [09:00 a.m.]	
ı	4	Date and time of end of remote e-voting	Saturday, 30 th May. 2020 [05:00 p.m.]	
l	5	Remote e-voting shall not be allowed beyond	Saturday, 30 th May, 2020 [05:00 p.m.]	
ı	6	Scrutinizer	Mr. Hitesh Buch, (CP No.: 8195),	
ı			Proprietor, Hitesh Buch & Associates, Practicing Company Secretaries	
ı	7	Contact details of the person at NSDL responsible to address the grievances connected to e-voting	Ms. Pallavi Mahtre, Manager, email: evoting@nsdl.co.in	
			or call on Toll free No.: 1800-222-990	

Members are informed that:

- Members can vote only through remote e-voting facility provided by NSDL as no physical ballot form is being dispatched or will be accepted by the Company.
- A member who has not received Postal Ballot Notice on their registered email address along with relevant Explanatory Statement and e-Voting instructions for remote e-Voting may obtain the same by sending an email to our RTA i.e. Link Intime India Private Limited at ahmedabad@linkintime.co.in and to the Company at investor@arvindinfra.com.
 - A copy of the Postal Ballot Notice and the procedure for registration of email addresses of members are also available on the website of the Company at www.arvindsmartspaces.com. The Postal Ballot Notice along with Explanatory Statement is also available on website of BSE Limited (www.bseindia.com) and National Stock Exchange of India Limited (www.nseindia.com) ("Stock Exchanges" where the equity shares of the Company are listed).
- Mr. Hitesh Buch, (CP No.: 8195), Proprietor, Hitesh Buch & Associates, Practicing Company Secretaries has been appointed as Scrutinizer for conducting remote e-voting process in accordance with the law and in a fair and transparent manner.
- For any queries/grievances, in relation to voting through electronic means, members may contact Registrar and Transfer Agent (RTA) i.e. Link Intime India Private Limited at ahmedabad@linkintime.co.in, the Scrutinizer at pcs.buchassociates@gmail.com or the Company at investor@arvindinfra.com.
- The result of the voting by Postal Ballot (through remote e-voting) shall be declared on or before Monday, 1st June, 2020. The results declared and the Scrutinizer's Report shall be made available at the Registered Office of the Company and on the Company's website and on the website of NSDL at www.evoting.nsdl.com besides being communicated to the Stock Exchanges where the Company's shares are listed.

For Arvind SmartSpaces Limited

Place: Ahmedabad Date: 29th April, 2020 Prakash Makwana

Company Secretary

The Indian Express. **♦**TheIndian **EXPRESS** For the Indian Intelligent. JOURNALISM OF COURAGE

Stay at Home, to Stay Safe



I arrive at a conclusion

not an assumption.

Inform your opinion with

detailed analysis.

We Safe, Nation Safe

Using the Ram baan of Aarogya Setu

To break the chain of COVID-19 transmission



One stop solution for all information related to COVID-19

- Aarogya Setu App acts as a life jacket. Your phone will automatically raise an alarm incase a COVID-19 affected person comes around you. This will help you save yourself from being infected.
- Act congenial by encouraging your friends, relatives and neighbours to download the Aarogya Setu App
- The app will notify you if you are in a Low Risk Zone or a High Risk Zone based on your location and social graph
- Find out through a Self Assessment Test on the app about the chances of being affected with COVID-19





Scan the QR Code and download

Download the Aarogya Setu App today itself to safeguard yourself from COVID-19 - Mr. Nitin Patel, Deputy Chief Minister, Gujarat

ITI Asset Management Limited Investment Manager for ITI Mutual Fund Registered Office: Naman Midtown, 'A' Wing 21st Floor, Senapati Bapat Marg, Prabhadevi Mumbai - 400 013

Toll Free No: 1800 266 9603 B: 022 6621 4999 • F: 022 6621 4998 E : mfassist@itiorg.com W:www.itimf.com CIN: U67100MH2008PLC177677

MUTUAL FUND Long-term wealth creators

NOTICE-CUM-ADDENDUM TO THE SCHEME INFORMATION DOCUMENT ('SID')/KEY INFORMATION MEMORANDUM ('KIM') OF THE SCHEMES OF ITI MUTUAL FUND AND STATEMENT OF ADDITIONAL INFORMATION ('SAI') OF ITI MUTUAL FUND ('THE FUND')

NOTICE is hereby given to all the investors/unit holders that ITI Mutual Fund ("the Fund"), ITI Asset Management Limited ("ITIAML") has decided to introduce "SIP Pause Facility" ('the Facility') for investors who wish to temporarily pause their existing Systematic Investment Plan ('SIP') in all open ended schemes of the Fund with effect from April 30, 2020.

The features, terms, and conditions for availing the facility are as follows:

- 1) Under this facility, Investor has an option to temporarily stop their SIP for specific number of instalments. i.e. Minimum 1 instalment and Maximum 6 instalments. SIP would restart upon completion of the period specified by Investor;
- 2) The minimum gap between the pause request and next SIP instalment date should be atleast 30 calendar days;
- 3) The facility shall not be available for SIP registered through Mutual Fund Utility ("MFU"), Stock exchange platforms, Channel Partners and Standing Instruction mode:
- 4) There would be no restriction on the number of times a SIP can be paused.
- The Trustee/AMC reserves the right to change, modify or withdraw this facility from time to time.

This Addendum shall form an integral part of the Statement of Additional Information (SAI), Scheme Information Document (SID) and Key Information Memorandum (KIM) of all existing and prospective schemes of ITI Mutual Fund, as amended from time to time

All other terms and conditions of the Scheme Information Document and Key Information Memorandum of the schemes of ITI Mutual Fund will remain unchanged.

> For ITI Asset Management Limited (Investment Manager for ITI Mutual Fund)

Place: Mumbai

George Heber Joseph

Date: April 29, 2020 Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

Place: Mumba

Chief Executive Officer & Chief Investment Officer

Union Mutual Fund

Union Asset Management Company Private Limited Investment Manager for Union Mutual Fund

Corporate Identity Number (CIN): U65923MH2009PTC198201

Registered Office: Unit 503, 5th Floor, Leela Business Park,

Andheri Kurla Road, Andheri (East), Mumbai - 400059

Toll Free No. 1800 2002 268/1800 5722 268:
 Non Toll Free. 022-67483333:

• Fax No: 022-67483401; • Website: www.unionmf.com; • Email: investorcare@unionmf.com

Ahmedabad

NOTICE CUM ADDENDUM TO THE SCHEME INFORMATION DOCUMENT (SID) AND KEY INFORMATION MEMORANDUM (KIM) OF DESIGNATED SCHEMES OF UNION MUTUAL FUND

Temporary modifications in the features of Systematic Investment Plan (SIP)

NOTICE is hereby given that Union Asset Management Company Private Limited, the Investment Manager of Union Mutual Fund, has decided to temporarily modify the below mentioned provision relating to Systematic Investment Plan (SIP) in the SID and KIM of all the existing schemes of Union Mutual Fund offering SIP Facility for the period April 29, 2020 to June 30, 2020 as follows

As per the existing provisions of the SID and KIM of the Schemes of Union Mutual Fund offering SIP Facility, if the Scheme fails to get the proceeds from three installments out of a continuous series of installments submitted at the time of initiating an SIP, the SIP is deemed as discontinued. This provision for discontinuation of SIP shall not be applicable for the period from April 29, 2020 to June 30, 2020 (both days inclusive). Consequently, any default in SIP instalments during the aforementioned period, will not be considered for the purpose of

All other provisions relating to the SIP Facility mentioned in the SID and KIM of the Scheme(s) of Union Mutual Fund offering SIP Facility shall remain unchanged.

The SID and KIM of the aforementioned Schemes of Union Mutual Fund will stand modified to the extent mentioned above, for the above

This Addendum forms an integral part of the SID and KIM of the aforementioned Schemes of Union Mutual Fund.

All other terms and conditions of the SID and KIM of the aforementioned Schemes will remain unchanged

For Union Asset Management Company Private Limited (Investment Manager for Union Mutual Fund)

Date: April 29, 2020 **Authorised Signatory** MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS, READ ALL SCHEME RELATED **DOCUMENTS CAREFULLY.**

Statutory Details: Constitution: Union Mutual Fund has been set up as a Trust under the Indian Trusts Act, 1882; Sponsors: Union Bank of India and Dai-ichi Life Holdings, Inc; Trustee: Union Trustee Company Private Limited [Corporate Identity Number (CIN): U65923MH2009PTC198198], a company incorporated under the Companies Act, 1956 with a limited liability; Investment Manager: Union Asset Management Company Private Limited [Corporate Identity Number (CIN): U65923MH2009PTC198201], a company

incorporated under the Companies Act, 1956 with a limited liability Copy of all Scheme Related Documents can be obtained from our website www.unionmf.com

સોના-ચાંદીમાં સામસામા રાહ: એલચી, સીપીઓ, મેન્થાતેલમાં નરમાઇ

કોમોડિટી બ્યૂરો મુંબઇ, તા. ૨૯

પ્રથમસત્રમાં રૂ. ૯૦૦૧.૧૮ કરોડનું ટર્નઓવર

મુંબઈઃ વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨૩૯૫૨૧ સોદામાં ૯૦૦૧.૧૮ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી હિસ્સો વાયદાઓનો ૮૮૫૨.૦૧ કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો ૧૪૯.૧૭ કરોડનો રહ્યો હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૮૭ ઘટ્યો હતો જ્યારે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૨૫૫વધ્યો હતો.અપવાદરૂપ ગોલ્ડ-ગિનીમાં ૮ ગ્રામદીઠ રૂ.પ૩૬નો ઝડપી ઉછાળો આવ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના એનર્જી ભાવમાં હતું. સેગમેન્ટમાં ક્રૂડતેલમાં પ્રત્યાઘાતી વૃદ્ધિ થઈ હતી, જ્યારે નેચરલ ર્ગેસ ઘટી આવ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસમાં વેચવાલીના દબાશે ભાવ ઘટી આવ્યાહતા,જયારેકોટનમાં ફરી સુધારાનો માહોલ હતો. એલચી, સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ ચાલુ રહી વાયદા વધુ ઘટ્યા હતા.

કોમોડિટી વાયદાઓમાં કીમતી સોના-ચાંદીના ધાતુઓમાં વાયદાઓમાં કુલ ૭૦૮૫૮ સોદાઓમાં રૂ. ૪૮૨૬.૧૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂં. ૪૫૯૨૫ ખૂલી, ઊપરમાં રૂ. ૪૬૧૭૭ અને નીચામાં રૂ. ૪૫૮૧૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૮૭ ઘટીને રૂ. ૪૫૮૭૯ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૩૬ વધીને ૮ ગ્રામદીઠ રૂ. ૩૭૬૩૫ અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૧ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ. ૪૭૦૦ થયા હતા, જ્યારે સોનું-મિની મે વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૮૩ ઘટીને બંધમાં રૂ. ૪૫૮૦૫ ના

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૪૧૮૧૪ ખૂલી, ઊપરમાં રૂ. ૪૨૦૭૫ અને નીચામાં રૂ. ૪૧૮૧૪ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૫૫વધીને રૂ. ૪૧૯૬૭બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ. ૨૩૬ વધીને રૂ. ૪૧૯૩૧ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.



ક્રૂડ તેલ મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૦૪૫ ખૂલી, ઊપરમાં રૂ. બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૦૮વધીને રૂ. ૧૧૧૩બંધરહ્યો હતો.

૧૬૦૪૦ સુધી જઈ પ્રથમ સત્રનાં કરોડ રૂ. ૧ ઘટીને બંધમાં રૂ. ૬૩૧.૯ ૩૨૯.૪૪૧ ટન, ક્રૂડ તેલમાં ના ભાવ હતા, જ્યારે એલચી મે ૧૦૩૯૧૭ સોદાઓમાં રૂ. વાયદો કિલોદીઠ રૂ. ૧૭૨૦.૨ ૧૫૯૧.૪૦

૧૯૬ વધીને રૂ. ૪૩૧૧૩ બંધ ખૂલી, અંતે રૂ. ૫૨.૬ ઘટીને રૂ. રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં ૧૭૨૦.૭થયો હતો. મેન્થા તેલ કુલ ૧૪૦૫૦૩ સોદાઓમાં રૂ. એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ. ૨૬૪૬.૩૧ કરોડનો ધંધો થયો ૧૨૨૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૨૩૭અને નીચામાં રૂ. ૧૨૨૧ રહી, અંતે રૂ. ૧૨૩૧.૩ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૧૧૩૨અને નીચામાં રૂ. ૧૦૩૦ ૨૦ કિલોદીઠ રૂ. ૯૫૯ ખૂલી, ઊપરમાં રૂ. ૯૬૩.૫ અને નીચામાં રૂ. ૯૫૯ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩.૫૦ કૃષિ કોમોડિટીઝમાં ૧૪૩૮ ઘટીને રૂ. ૯૬૧.૫ ના સ્તરે બંધ સોદાઓમાં કુલ રૂ. ૧૧૩.૬૫ રહ્યો હતો. વાયદાઓમાં કરોડનાં કામકાજ થયાં હતાં. કામકાજની દેષ્ટિએ પ્રથમ સત્ર કોટન એપ્રિલ વાયદો ગાંસડીદીઠ સુધીમાં સોનાના વિવિધ રૂ. ૧૬૦૮૦ ખૂલી, ઊપરમાં રૂ. વાયદાઓમાં મળીને ૨૪૪૦૭ ૧૬૦૮૦ અને નીચામાં રૂ. સોદાઓમાં કુલ રૂ. ૩૪૨૬.૧૨ કીમતનાં અંતે રૂ. ૩૦ વધીને રૂ. ૧૬૦૬૦ ૭૪૪૮.૫૫૬ કિલો, ચાંદીના ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ વિવિધ વાયદાઓમાં મળીને એપ્રિલ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ. ૪૬૪૫૧ સોદાઓમાં કુલ રૂ. ૬૩૩ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે ૧૪૦૦.૦૬ કરોડ ની કીમતનાં

यूको बैंक 📦 UCO BANK

UCO Bank invites Request for Proposals (RFPs) for the following: 1. Request for Proposal (RFP) for Selection of SMS Aggregator for Implementation of SMS and Co-Related Services. 2. RFP for Selection of IT consultant on Retainer Basis.

NOTICE INVITING TENDER

3. RFP for Selection of Vendor for Implementation of National Electronic Toll Collection (NETC) as an issuer under OPEX Model for Issuance of FASTag.

For any details, please refer to https://www.ucobank.com.

Deputy General Manager (DIT, BPR & BTD) Date:30.04.2020



MAHANADI COALFIELDS LIMITED

(A Subsidiary of Coal India Limited) Jagruti Vihar, Burla - 768020, Dist. - Sambalpur, Odisha (EPABX): 0663-2542461 to 469 Website: www.mahanadicoal.ii NOTICE

All the tenders issued by CIL and its Subsidiaries for procurement of Goods, Works and Services are available on website of Coal India Ltd www.coalindia.in, respective subsidiary Company, (MCL, www.mahanadicoal.in), CIL e-Procurement portal https://coalindiatenders.nic.in and Central Public Procurement Portal https://eprocure.gov.in. In addition, procurement is also done through GeM portal https://gem.gov.in

98850600

૨૧૨૬૦.૪૯૩ કિલો, ચાંદીના ૪૩૦૦૦ એલચીમાં ૩.૮ ટન, મેન્થા રૂ.૨૨૫બંધરહ્યો હતો.

ટનના વેપાર થયા હતા.

ગાંસડી, સીપીઓમાં ૧૧૪૫ ઓપ્શન્સનો હિસ્સો ૫૮.૬૯ ૪૩૦૦૦ ૦.૮ ટન, મેન્થા તેલમાં ૨૨ ઓપ્શન્સનો રૂ. ૪૬૦૦૦ ની ૧૫.૮૪ ટન, કપાસમાં ૨ ૧૦ ગ્રામદીઠરૂ.૯૦૯.૫ખૂલી, સુધીમાં સોનાના વાયદાઓમાં જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ક્રૂડ તેલમાં ૧૫૨૧૫ બેરલ્સ, ગ્રામદીઠ રૂ. ૨૦૧ ખૂલી, કોટનમાં ૧૪૭૧૫૦ ગાંસડી, ઊપરમાં રૂ. ૨૪૦અને નીચામાં સીપીઓમાં ૫૫૨૮૦ ટન, રૂ. ૧૯૦૨હી પ્રથમ સત્રનાં અંતે રહ્યો હતો,

તેલમાં ૫૪ ટન અને કપાસમાં ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ ૩૪૪ ટનના સ્તરે રહ્યો હતો. સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ કોમોડિટી ઓપ્શન્સમાં કુલ ૩. ઓપ્શન્સનો ૩. ૪૫૦૦૦ ની ૧૪૯.૧૭ કરોડનું ટર્નઓવર સ્ટ્રાઈક પ્રાઈસવાળો જૂન કોન્ટ્રેક્ટ (નોશનલ) થયું હતું, જ્યારે કિલોદીઠ રૂ. ૧૩૭૦ ખૂલી, પ્રીમિયમ ૮.૦૧ કરોડ નું રહ્યું ઊપરમાં રૂ. ૧૩૭૦ અને

બેરલ્સ, હતું.ઓપ્શન્સના કુલ વોલ્યુમમાં નીચામાં રૂ. ૧૩૪૯ રહી પ્રથમ કોટનમાં ૨૬૧ સોદાઓમાં રૂ. કોલ ઓપ્શન્સનો હિસ્સો સત્રનાં અંતે રૂ. ૧૩૬૫ બંધ રહ્યો ૧૪.૨૪ કરોડનાં ૮૭૭૫ ૪૧.૩૧ ટકાનો અને પુટ હતો,જયારેપુટઓપ્શન્સમાંરૂ. સોદાઓમાં રૂ. ૯૭.૩૪ કરોડનાં ટકાનો હતો. સોનાનાં પ્રાઈસવાળો જન કોન્ટ્રેક્ટ ૧૬૧૮૦ ટન, એલચીમાં ૮ ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય ક્લિોદીઠ રૂ. ૨૪૮૫.૫ ખૂલી, સોદાઓમાં રૂ. ૧૩.૧૪ લાખનાં રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઊપરમાં રૂ. ૨૫૫૧ અને નીચામાં રૂ. ૨૪૮૫.૫ રહી સોદાઓમાં રૂ. ૧.૯૦ કરોડનાં સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૫૨૨ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં સોદાઓમાં રૂ. રૂ.૮૫લાખનાં ૮ ઊપરમાં રૂ. ૯૬૯ અને નીચોમાં ઓપ્શન્સમાં સૌથી વેધુ સક્રિય રૂ. ૮૭૨.૫ રહી પ્રથમ સત્રનાં રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર અંતે રૂ. ૮૯૨ બંધ રહ્યો હતો, ઓપ્શન્સનો રૂ. ૧૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ની સ્ટ્રાઈક બેરલદીઠ રૂ. ૧૪૫ ખૂલી, વાયદાઓમાં ૨૭૮.૭૧૯ ટન, પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ઊપરમાં રૂ. ૧૫૭.૮ અને નીચામાં રૂ. ૧૨૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૪૧.૮ બંધ

> જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૧૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૨૬૦ ખૂલી, ઊપરમાં રૂ. ૨૭૩ અને નીચામાં રૂ. ૨૨૪.૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૩૬.૧ બંધ

વિલફુલ ડિફોલ્ટર્સ યુપીએ શાસન હેઠળ લાભાર્થીઓ હતા : નિર્મલા

પી ટીઆ ઈ

નવી દિલ્હી, તા.૨૯

કોંગ્રેસ પક્ષ પર શાબ્દિક પ્રહારો કરતાં, નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે વિલફુલ ડિફોલ્ટર્સ એ યુપીએ શાસન હેઠળના ફોન બેંકિંગના લાભાર્થી હતા અને મોદી સરકારે તેઓને પકડી પાડયા છે અને તેઓ પાસેથી બાકી ૨કમ વસુલવામાં આવી રહી છે. માર્ચ ૨૦૨૦ના અંતે પુરા થયેલા નાણાકીય વર્ષના પ્રથમ છ માસ દરમિયાન ટોચના ૫૯ વિલફુલ ડિફોલ્ટર્સની બાકી લોનોની રકમ રૂપિયા ૬૮,૬૦૭ કરોડ માંડવાળ કરવામાં આવી હોવાના વિરોધપક્ષના આક્ષેપનો તેમણે ઉપર મુજબ જવાબ આપ્યો

નાણા પ્રધાને, મંગળવારે મોડી રાત્રે કરેલી સંખ્યાબંધ ટ્વિટસ મારફત, જણાવ્યું હતું કે કોંગ્રેસ કે જેણે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે તેણે અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ આત્મ પરિક્ષણ કરવું જોઇએ કે શા માટે સિસ્ટમને સ્વચ્છ કરવાની તેમની રચનાત્મક ભુમિકા ભજવવામાં

પોસ્ટલ બેલટની નોટીસ (રીમોટ ઇ–વોટીંગ મારફત)

આથી નોટીસ આપવામાં આવે છે કે, કંપની કાયદા, ૨૦૧૩ **(કાયદ્રો**) ની કલમ ૧૧૦ ની જોગવાઇઓ સાથે વંચાતા કંપની (વ્યવસ્થાપન અને પ્રશાસન)

નિયમો, ૨૦૧૪ **(નિયમો**) ના નિયમ ૨૦ અને ૨૨, સિક્યોરીટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર

રીક્વાયરમેન્ટસ) નિયમનો, ૨૦૧૫ **(સેબી એલઓડીઆર રેગ્યુલેશન્સ)** અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા જનરલ સરક્યુલર

નં.૧૪/૨૦૨૦ તારીખ ૮મી એપ્રિલ, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૧૭/૨૦૨૦ તારીખ ૧૩મી એપ્રિલ, ૨૦૨૦ **(જનરલ સરક્યુલર્સ)**, અન્વયે

કંપનીએ તારીખ ૨૪ એપ્રિલ, ૨૦૨૦ ની પોસ્ટલ બેલટ નોટીસમાં જણાવેલ ખાસ કામકાજો માટે સભ્યોની મંજુરી માંગેલ છે. સભ્યોને જાણ કરવામાં આવે

છે કે પોસ્ટલ બેલટ નોટીસ તેમજ સબંધિત ખુલાસા નિવેદનો અને રીમોટ ઇ-વોટીંગ દ્વારા મત આપવાની સુચનાઓ એવા સભ્યોને ઇમેઇલ દ્વારા મોકલેલ છે 🤅

આથી સભ્યોને જાણ કરવામા આવે છે કે, જેમના નામ શુક્રવાર, ૨૪ એપ્રિલ ૨૦૨૦ **(કટ-ઓફ ડેટ**) ના રોજ રજીસ્ટર ઓફ મેમ્બર્સ/નેશનલ સિક્યોરીટીઝ

ઉપોઝીટરી લીમીટેડ **(એનએસડીએલ**) અને સેન્ટલ ઉપોઝીટરી સર્વિસીઝ(ઇન્ડિયા) લીમીટેડ **(સીડીએસએલ)** પાસેથી મળેલ બેનિફિસિયલ ઓનર્સની યાદીમાં

આવ્યા છે તેમને ઇમેઇલ દ્વારા પોસ્ટલ બેલટ નોટીસ મોકલવામાં આવી છે. કટ-ઓફ ડેટના રોજ સભ્યોના નામે રજીસ્ટર્ડ શેરોની ભરપાઇ થયેલ મુડી પર મતન

સભ્યોએ ખાસ નોંલ લેવી કે નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) ના પ્રસારને રોકવા માટે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને

પગલે અને જનરલ સરક્યુલર્સના આધારે કંપનીએ પોસ્ટલ બેલટ ફોર્મ મોકલેલા નથી અને સભ્યો ફક્ત રીમોટ ઇ-વોટીંગથી જ મત આપી શકશે

જનરલ સરક્યલર્સના આધારે. કટ–ઓફ ડેટના રોજ જે સભ્યોના ઇમેઇલ એડેસ કંપની અથવા ડીપોઝીટરી પાર્ટીશીપન્ટની યાદીમાં ન હતા તેવા સભ્યો કંપનીના

આરટીએ એટલે કે લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડને <u>ahmedabad@linkintime.co.in</u> અથવા કંપનીને <u>investor@arvindinfra.com</u>

પર ઇમેઇલ કરીને પોસ્ટલ બેલટમા જણાવેલ ખાસ કામકાજો પર તેમના મત આપવા માટે પોતાના ઇમેઇલ રજીસ્ટર્ડ કરાવી શકે છે. આ રજીસ્ટેશન માટે સભ્યોએ

પોતાની જરૂરી વિગતો જેવી કે રજીસ્ટર્ડ સભ્યનું નામ, ફ્રીલિયો નંબર/ડીપી આઇડી/કલાઇન્ટ આઇડી અને શેરોની સંખ્યા ઇમેઇલ દ્વારા ''એએસએલ - પોસ્ટલ

બેલટ - ઇમેઇલ એડ્સ રજીસ્ટેશન" ના શીર્ષક હેઠળ આપવાની રહેશે. એવા સભ્યો કે જેમના ઇમેઇલ એડ્રેસ કંપની અથવા ડિપોઝીટરી પાર્ટીશીપન્ટ પાસે

કાયદાની કલમ ૧૦૮ ની જોગવાઇઓ, નિયમો, જનરલ સરક્યુલર્સ અને સેબી એલઓડીઆરના નિયમન ૪૪ મુજબ, કંપનીએ તેના સભ્યો દ્વારા મત આપવા

બુધવાર, ૨૯ એપ્રિલ, ૨૦૨૦

હકોની ગણતરી થશે. જેઓ કટ–ઓફ ડેટના રોજ કંપનીના સભ્યો ન હતા તેઓ માટે આ નોટીસ ફક્ત માહિતીના હેતુસર લેવાની રહેશે.

ાત. દવરા ૧૭૦૨૦૦૦૦ ૧૯૦૦૦*૦૦૧* **રજીસ્ટર્ડ ઓફીસ** : ૨૪,ગર્વમેન્ટ સર્વન્ટસ સોસાચટી, મ્યુનિસિપલ માર્કેટ પાસે, સી. જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ–૩૮૦૦૦

કોંગ્રેસ કેમ નિષ્ફળ રહી હતી. વર્ષ ૨૦૦૯-૧૦ અને २०१३-१४ દરમિયાન શિડ્યૂલ્ડ કોમર્સિયલ બેંકોએ રૂ પિયા ૧,૪૫,૨૨૬ કરોડ માંડવાળ કરી નાખ્યા હતા તેને હાઇલાઇટ કરતા, તેમણે એવો કટાક્ષ કર્યો હતો કે, આ ૨કમની માંડવાળ કરવા અંગે ગાંધીએ પુર્વ વડાપ્રધાન મનમોહન સિંઘની સલાહ લીધી હશે તેવી આશા છે. તેમણે એવા મિડિયા રિપોર્ટસનો ઉદ્ઘેખ કર્યો હતો જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે મોટી સંખ્યાની બેડ લોન્સ મૂળ ૨૦૦૬થી સમયગાળામાં આપવામાં આવેલી હતી અને ઘણી લોનો વેલ કનેક્ટેડ પ્રમોટર્સને આપવામાં આવી હતી જેઓ તેઓની લોનોમાં ડિફ્રોલ્ટ ઇતિહાસ ધરાવતા હતા. તેઓ આવી લોનો પુનઃ ભરપાઇ કરી શકે તેવી ક્ષમતા ધરાવતા હોવા છતાં આવી બાકી ૨કમ ચુકવતા

અરવિંદ સ્માર્ટસ્પેસીસ લીમીટેક

Western Coalfields Limited 250 (A Subsidiary of Coal India Limited)

COMMON WINDOW ADVERTISEMENT

All the tenders issued by WCL for procurement of Goods, Works and Services are available on website of Coal India Ltd. www.coalindia.in/respective subsidiary Company, CIL e-procuremen portal http://coalindiatenders.nic.in and Central Public Procuremen Portal https://eprocure.gov.in. In addition, procurement is also done through GeM Portal https://gem.gov.in - informs the G.M.(MM)HOD, WCL, Coal Estate, Civil Lines, Nagpur (M.S.). PIN.: 440001.

GENERAL NOTICE

Tenders of WCL HQ / Areas are available at: (i) www.coalindiatenders.nic.in, (ii) www.eprocure.gov.in. Bids can be submitted on line through www.coalindiatenders.nic.in Corrigendum/Addendum, if any, are published in www.coalindiatenders.nic.in only - informs the General Manage (CMC), WCL HQ, Coal Estate, Civil Lines, Nagpur - 440001.



SUNDARAM HOME

Revision of Interest Rates on Fixed Deposits / Renewals effective 01.05.2020 as follows



TERM	SENIOR CITIZENS	INDIVIDUALS OTHER THAN SENIOR CITIZENS	TRUSTS		
in months	Rate of Interest % (p.a. at Quarterly rests for Regular Income Scheme and Cumulative Deposit Scheme)	Rate of Interest % (p.a. at Quarterly rests for Regular Income Scheme and Cumulative Deposit Scheme)	Rate of Interest % (p.a. at Quarterly rests for Regular Income Scheme and Cumulative Deposit Scheme)		
12	7.00	6.75	6.75		
18	7.00	6.75	6.75		
24	7.25	7.00	7.00		
36	7.25	7.00	7.25		
48	7.25	7.00	7.25		
60	7.25	7.00	7.25		
Monthly interest antion available under 26 / 49 / 60 month denseits					

Monthly interest option available under 36 / 48 / 60 month deposits

- Minimum Deposit of ₹ 10,000/- per account. Interest rates on existing deposits remain unchanged. Trust deposits are specified investment under section 11(5)(ix) of Income-tax Act, 196 Senior Citizens - Completed 60 years of age on date of deposit / renewal.
- This advertisement appears further to the statutory advertisement published by the Company in

The text of the statutory advertisement is also printed on all application forms which may be referred to efore investing in the Company's Deposit Schemes.

Sundaram Home Finance Limited

Registered Office: 21, Patullos Road, Chennai - 600 002. Phone: (044) 2852 1181 (General), 2888 1780 / 2852 0391 / 2888 1781 (Deposits) Corporate Office: "Sundaram Towers", 46, Whites Road, Chennai - 600 014. Phone: (044) 2851 5267, 2851 5269, Fax: (044) 2858 2235 e-mail: depositorcare@sundaramhome.in Website: www.sundaramhome CIN: U65922TN1999PLC042759

ક્રમ વિગતો

૨. સભ્યોના મતદાન હકોની ઓળખ માટે કટ-ઓફ તારીખ શક્રવાર. ૨૪ એપ્રિલ. ૨૦૨૦ રીમોટ ઇ -વોર્ટીંગની શરૂઆતની તારીખ અને સમય શક્રવાર. ૧ મે. ૨૦૨૦ (૦૯.૦૦ a.m.) રીમોટ ઇ-વોટીંગની સમાપ્રિની તારીખ અને સમય શનિવાર, ૩૦મે, ૨૦૨૦ (૦૫.૦૦ p.m.) ત્યારબાદ રીમોટ ઇ-વોર્ટીંગની મંજુરી મળશે નહી શ્રી હિતેષ બુચ, (સીપી નં. : ૮૧૯૫) પ્રોપરાઇટર, હિતેષ બુચ અને એસોસિયેટસ, વ્યવસાયિક કંપની સચીવ ખાતે જવાબદાર વ્યક્તિની સંપર્ક વિગતો

નોંધાયેલ નથી, તેવા સભ્યો પોસ્ટલ બેલટ નોટીસની સુચના નં. ૭ મુજબ રીમોટ ઇ-વોટીંગથી મત આપી શકે છે.

માટે એનએસડીએલ સાથે રીમોટ ઇ-વોટીંગની વ્યવસ્થા કરી છે.

પોસ્ટલ બેલટ નોટીસની રવાનગી પુર્ણ કર્યાની તારીખ

પોસ્ટલ બેલટની વિગતો:

જેમના નામની યાદી કટ- ઓફ ડેટના રોજ કંપની અથવા ડિપોઝીટરી પાર્ટીશીપન્ટના રેકોર્ડમાં હતી.

૧. સભ્યો ફક્ત એનએસડીએલ દ્વારા અપાયેલ રીમોટ ઇ-વોર્ટીંગ સુવિધા દ્વારા જ મત આપી શકે છે કારણકે, કોઇ પોસ્ટલ બેલટ ફોર્મ રવાના કર્યા નથી અથવા કંપની દ્વારા સ્વીકારવામાં આવશે નહી. સભ્યો જેમને તેમના રજીસ્ટર્ડ ઇમેઇલ એડ્રેસ પર પોસ્ટલ બેલટ નોટીસ તેમજ સબંધિત ખુલાસા નિવેદનો અને રીમોટ ઇ-વોટીંગની ઇ-વોટીંગ સુચનાઓ મળી

નથી તેઓ તે અમારા આરટીએ એટલે કે લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડને <u>ahmedabad@linkintime.co.in</u> અથવા investor@arvindinfra.com પર ઇમેઇલ મોકલીને મેળવી શકે છે. પોસ્ટલ બેલટ નોટીસની નકલ અને સભ્યોના ઇ–મેઇલ એડ્રેસ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કંપનીની વેબસાઇટ <u>www.arvindsmartspaces.com</u> પર પણ

ઉપલબ્ધ છે. પોસ્ટલ બેલટ નોટીસ તેમજ ખુલાસા નિવેદનો બીએસઇ લીમીટેડ (<u>www.bseindia.com</u>) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડ (<u>www.nseindia.com</u>) ની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. (સ્ટોક એક્સચેન્જ જેમાં કંપનીના ઇક્વિટી શેરો લીસ્ટેડ છે) શ્રી હિતેશ બુચ (સીપી નં. : ૮૧૯૫), પ્રોપરાઇટર, હિતેશ બુચ એન્ડ એસોસિયેટ્સ, વ્યવસાયિક કંપની સચીવની કાનુન મુજબ યોગ્ય અને પારદર્શક પદ્ધતિમાં રીમોટ ઇ-વોર્ટીંગ/પોસ્ટલ બેલટનું સંચાલન કરવા માટે સ્ક્રુટીનાઇઝર તરીકે નિમણુંક કરવામા આવી છે.

ઇલેક્ટ્રોનિક માધ્યમોથી વોટીંગને સબંધિત કોઇપણ પુછપરછ/ફરિયાદ માટે સભ્યો (આરટીએ) એટલે કે લિંક ઇનટાઇમ પ્રાઇવેટ લીમીટેડનો ahmedabad@linkintime.co.in, સ્ક્રુટીનાઇઝરનો pcs.buchassociates@gmail.com investor@arvindinfra.com પર સંપર્ક કરી શકે છે.

કરેલ પરિણામો અને સ્ક્રુટીનાઇઝરનો અહેવાલ કંપનીની રજીસ્ટર્ડ ઓફીસે અને કંપનીની વેબસાઇટ પર અને એનએસડીએલની વેબસાઇટ www.evoting.nsdl.com પર પણ ઉપલબ્ધ રહેશે. આ સિવાય સ્ટોક એક્સચેન્જ જેમાં કંપનીના શેરો લીસ્ટેડ છે તેને પણ જાણ કરવામાં આવશે

અરવિંદ સ્માર્ટસ્પેસીસ લીમીટેક વર્ત

સ્થળ: અમદાવાદ

પ્રકાશ મકવાણ

Assuming the Company buys back the Maximum Buyback Shares. However, the shareholding post completion of the Buyback may differ depending upon the actual number of Equity Shares bought back in

- 10.4. As per Regulation 16(ii) of the Buyback Regulations, the Buyback shall not be made from the promoter and members of the promoter group and persons in control of the Company. Further, as per Regulation 24(i)(e) of the Buyback Regulations, the promoter and members of the promoter group of the Company and their associates have not dealt in the Equity Shares or other specified securities of the Company either through the Stock Exchanges or off-market transactions (including inter-se transfer of Equity Shares among the promoter and members of the promoter group of the Company) from the date of the Board Meeting till the date of the Public Announcement and shall not deal in the Equity Shares or other specified securities of the Company either through the stock exchanges or off-market transactions (including inter-se transfer of Equity Shares among the promoters and members of the promoter group of the Company) from the date of the Public Announcement till the completion of the Buyback.
- 10.5. For the aggregate shareholding of the promoter and members of the promoter group of the Company as or the date of the Board Meeting i.e. April 28, 2020, please refer to Paragraph 6.1 of Part A. For the details of the transactions undertaken by the promoter and members of the promoter group of the Company, please refer to
- 10.6. While the promoter and members of the promoter group of the Company are not eligible to participate in the Buyback, depending on the number of Equity Shares bought back by the Company, their effective shareholding percentage in the Company, will increase consequent to the buyback. Any increase in the percentage holding voting rights of the promoter and members of the promoter group is not an active acquisition and is incidental to the Buyback and falls within the limits prescribed under the SEBI (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011, as amended.
- MANAGEMENT DISCUSSION AND ANALYSIS ON THE LIKELY IMPACT OF THE BUYBACK ON THE
- The Buyback is expected to achieve the objective of returning surplus funds to the shareholders, optimizing the capital structure, improving return on equity through distribution of surplus funds, improving earnings per share by reduction in equity base and increasing shareholders' value in the long term. The Buyback is not likely to cause any material impact on the profitability / earnings of the Company except a reduction in the investment income, which the Company could have otherwise earned on the amount distributed towards Buyback. The Buyback may lead to reduction in outstanding Equity Shares, improvement in 'earnings per share' and enhanced return on equity, assuming that the Company would earn similar profits as in the past.
- 11.2. The amount required by the Company for the Buyback (including the Transaction Costs) will be funded out of the securities premium account, free reserves and/or such other sources as may be permitted by the Buyback Regulations and the Companies Act, 2013 and on such terms and conditions as the Board may deem fit. 11.3. Pursuant to Regulation 16(ii) of the Buyback Regulations, the promoter and members of the promoter group
- and persons in control of the Company shall not participate under the Buyback. The Buyback of Equity Shares will not result in a change in control or otherwise affect the existing management structure of the Company. 11.4. Consequent to the Buyback and based on the number of Equity Shares bought back from the shareholders excluding the promoter and the members of the promoter group of the Company, the shareholding pattern of the Company would undergo a change. Pursuant to Regulation 16(ii) of the Buyback Regulations, the promoter and promoter group of the Company are not entitled to participate under the Buyback. The Buyback of Equity Shares will not result in a change in control or otherwise affect the existing management structure of the Company and will not result in the public shareholding falling below 25% of the total fully paid-up equity share
- 12.1. Pursuant to Sections 68, 69, 70, and all other applicable provisions of the Act and applicable rules thereunder and the provisions of the Buyback Regulations and the Articles of Association of the Company, the Company

has obtained the Board approval as mentioned above

- 12.2. The Buyback is subject to receipt of such sanctions and approvals from statutory, regulatory or governmental authorities as may be required under applicable laws, including the Reserve Bank of India, the Securities and Exchange Board of India ("SEBI"), and the stock exchanges on which the Equity Shares are listed, namely, National Stock Exchange of India Limited ("NSE") and BSE Limited ("BSE") (hereinafter together referred to
- as the "Stock Exchanges") 12.3. The shareholders shall be solely responsible for obtaining all such statutory consents and approvals (including without limitation the approvals from the Reserve Bank of India and/or the SEBI, if any) as may be required by them in order to sell their Equity Shares to the Company pursuant to the Buyback. Shareholders would be required to provide copies of all such consents and approvals obtained by them to the Company's Broker.
- 12.4. The Buyback shall be subject to such necessary approvals as may be required, and the Buyback from overseas corporate bodies and other applicable categories shall be subject to such approvals of the Reserve Bank of India, if any, under the Foreign Exchange Management Act, 1999 and the rules and regulations framed
- 12.5. To the best of the knowledge of the Company, no other statutory approvals are required by it for the Buyback as on the date of this Public Announcement. Subject to the obligation of the shareholders to obtain the consents and approvals necessary for transfer of their Equity Shares to the Company as set out in Paragraphs 12.3 and 12.4 of Part B above, the Company shall obtain such statutory approvals as may be required, from time to time, if any, for completion of the Company's obligations in relation to the Buyback.
- COLLECTION AND BIDDING CENTRES AND INVESTOR SERVICE CENTRES

The Buyback will be implemented by the Company by way of open market purchases through the Stock Exchanges using their nationwide trading terminals. Therefore, the requirement of having collection and bidding centers and investor service centres is not applicable.

COMPLIANCE OFFICER

The Company has designated the following official as the Compliance Officer for the Buyback: : Suresh Chander Gupta

Designation: Vice President and Company Secretary and Compliance Officer : Gulab Bhawan (Rear Block - 3rd Floor), 6A, Bahadur Shah Zafar Marg, New Delhi - 110 002 Address

: +91 3017 9100 Fmail ID : scgupta@jkmail.com : www.jkpaper.com

In case of any clarifications or to address investor grievance, the Shareholders may contact the Compliance Officer, from Monday to Friday between 10 a.m. to 5 p.m. on all working days except Saturdays, Sundays and public holidays, at the above-mentioned address.

REGISTRAR TO THE BUYBACK The Company has appointed the following as the registrar to the Buyback ("Registrar"):

MCS Share Transfer Agent Limited Address : F-65, Okhla Industrial Area, Phase- 1, New Delhi – 110 020

Contact Person Email ID

Fax

: +91 4170 9881 : Ajay Dalal : admin@mcsregistrars.com

: www.mcsregistrars.com SEBI Registration Number : INR000004108 Validity Period : U67120WB2011PLC165872

In case of any query, the Shareholders may also contact the Registrar to the Buyback, from Monday to Friday between 10:00 a.m. to 5:00 p.m. on all working days except Saturdays, Sundays and public holidays at the

MERCHANT BANKER / MANAGER TO THE BUYBACK The Company has appointed the following as the Merchant Banker / Manager to the Buyback

JM FINANCIAL

Address : 7th Floor, Cnergy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai - 400 025,

Maharashtra, India : +91 22 6630 3030 : +91 22 6630 3330 **Contact Person** : Prachee Dhuri Email : jkpaper.buyback@jmfl.com

: www.jmfl.com

SEBI Registration Number : INM000010361 Validity Period : Permanent Registration : L67120MH1986PLC038784

DIRECTORS' RESPONSIBILITY STATEMENT

As per Regulation 24(i)(a) of the Buyback Regulations, the Board of Directors accepts full and final responsibility for all the information contained in this Public Announcement and any advertisements, circulars, brochures, publicity materials etc. which may be issued in relation to the Buyback and confirms that the information in such documents contain and will contain true, factual and material information and does not and will not contain any misleading information.

> For and on behalf of the Board of Directors of JK Paper Limited

> > and Compliance Officer

ICSI Membership Number: F1741

Sd/-Sd/-Harsh Pati Singhania Amar Singh Mehta Suresh Chander Gupta President & Director Vice President and Company Secretary

DIN: 00030694

Managing Director

DIN: 00086742

Date: April 29, 2020 Place: New Delhi

Tel

Fax

Website

CONCEPT